

## નિયમ સંગ્રહ-૧૭

૧૭.૬ જાહેરતંત્રે ઉઘરાવવા અંગે

(મ્યુનિસિપલ કોર્પોરેશન, વ્યવસાય વેરો, મનોરંજન વેરો વિગેરે)

વેરા બાબતે કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.

- વેરાનું નામ.
- વેરો લેવાનો હેતુ
- કર નિર્ધારણ માટેની કાર્યવાહી અને માપદંડ.
- મોટા કસુરદારોની યાદી
- ૧૭.૭ વીજળી/પાણી હંગામી અને કાયમી જોડાણો આપવા અને કાપવા અંગે  
(આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન/નગરપાલિકા/યુપીસીએલને લાગુ પડશે)  
(પીવાના પાણીના કનેક્શન પાણી પુરવઠા અને ગટ્ઠર વ્યવસ્થા બોર્ડ દ્વારા આપવામા આવે છે.)
- જોડાણ માટેની પાત્રતા  
ગ્રામ પંચાયત/નગરપાલિકા/મહાનગરપાલિકા/જાહેર તેમજ ખાનગી સંસ્થાઓ
- પુર્વ જરૂરિયાતો (જો હોય તો)
- અરજી માટેની સંપર્ક માહિતી  
ક્ષેત્રીય કક્ષાએ જે તે વિભાગીય કચેરીઓ
- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અન્ય ફી શુલ્ક (લાગુ પડતું હોય ત્યાં)
- અરજીનો નમુનો (જો અરજી સાદા કાગળ ઉપર કરવામા આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો)  
સાદા કાગળ ઉપર અને ઓધોગિક જોડાણ માટે ગુજરાત સરકારના IFP Portal પર.
- બિડાણો/દસ્તાવેજોની યાદી  
સહમતી પત્રક.
- બિડાણ/દસ્તાવેજોનો નમુનો  
નથી.
- અરજી કરવાની પદ્ધતિ  
વિભાગીય કચેરીને અરજી કરવાની રહે.
- અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા
- બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવે છે.
- બિલમાં વાપરેલ શબ્દ પ્રયોગનું ટુંકું વિવરણ  
પાણી વેરો
- બિલ અથવા સેવાની બાબતમાં મુશ્કેલી હોય તો સંપર્ક માહિતી
- ટેરીફ અને અન્ય ખર્ચ

અ.નં.	સંસ્થા	શુલ્ક
૧	ગ્રામ પંચાયત	નર્મદા,જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તા.૮/૨/૨૦૦૭ના પરિપત્ર મુજબ છે.
૨	નગરપાલિકા/નગરપંચાયત	
૩	મ્યુનિ.કોર્પોરેશન	
૪	શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તથા આરોગ્ય સંસ્થાઓ	
૫	ઓધોગિક વપરાશ માટેના પાણીનું જોડાણ.	નર્મદા,જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તા.૧૬/૭/૨૦૧૮ના પરિપત્ર મુજબ છે.

**નોંધ:**

જોડાણ અને કપાત માટેની શરતો બોર્ડની કચેરીના પત્ર તા.૧૫/૩/૨૦૧૬ મુજબ છે અને ઇંડની બાબત ગુજરાત સરકારના તા.૨૨/૮/૨૦૧૯ના ગેઝેટથી અમલીકરણમાં મુકેલ “ ગુજરાત ડોમેસ્ટીક વોટર સપ્લાય” (પ્રોટેક્શન) એક્ટ-૨૦૧૯ મુજબ છે.

૧૭.૮ જાહેર તંત્ર (ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ) દ્વારા પુરી પાડવામા આવનાર અન્ય સેવાઓની વિગત નીચે મુજબ છે.

#### (૧) બાંધકામ

પીવાના પાણીની યોજના માટેના સમગ્ર કામોની બાંધકામની કામગીરી કરવી. તાંત્રિક સક્ષમતાની ચકાસણી કરવી. અમલીકરણ કરવું. અને યોજના ચાલુ કર્યા બાદ જે તે સ્થાનિક સંસ્થાને મરામત અને નિભાવણી માટે સોંપવી. આ માટે સરકારશ્રીના નિયમોનુસારનું શુલ્ક બોર્ડ દ્વારા વસુલ કરવામા આવે છે.

#### (૨) ડીઝાઇન

સ્થાનિક સંસ્થા દ્વારા પાણી પુરવઠા યોજના માટે માંગણી/રજુઆત આવ્યા બાદ જે તે વિસ્તારની સ્થળ મુલાકાત લઈ પીવાના પાણીના યોજનાના ઘટકોની તાંત્રિક ડીઝાઇન કરવી. અને સમગ્ર યોજના તૈયાર કરવાની કામગીરી કરવી. આ માટે સરકારશ્રીના નિયમોનુસારનું શુલ્ક બોર્ડ દ્વારા વસુલ કરવામા આવે છે.

#### (૩) જાહેર મેળાવડા અને જાહેર સંભારંભોમાં પીવાના પાણીની વ્યવસ્થા

રાજ્ય સરકારશ્રીના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની સુચના મળ્યાથી જાહેર મેળાવડા/સમારંભોમાં પીવાના પાણીની સગવડ કરવી.

#### (૪) સ્થાનિક સંસ્થાઓની યોજના

સ્થાનિક સંસ્થાઓની પીવાના પાણીની યોજનાઓમાં નિયમ મુજબ તાંત્રિક ચકાસણી, સુપરવીઝન ચાર્જીસ વગેરે લઈ પીવાના પાણીની યોજનાની કામગીરી કરવી.